

ત્વરિત જાહેરાત માટે

વસંતઋતુના આગમનને સીડ્ડી સેટરડે (પુષ્કળ બીવાળા શનિવાર) અને ગાર્ડન શો (બગીચાના પ્રદર્શન) સાથે ઉજવો

બ્રમ્પટન, ઓન્ટેરિયો (ફેબ્રુઆરી 18, 2020) – વસંતઋતુના આગમનની તૈયારી છે અને તેથી સીટી ઓફ બ્રમ્પટનનો 8મો વાર્ષિક સીડ્ડી સેટરડે અને ગાર્ડન શો ઉજવવા તૈયાર રહો!

આ વર્ષનો સીડ્ડી સેટરડે અને ગાર્ડન શો ફેબ્રુઆરી 29 નાં રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી સેન્યુરી ગાર્ડન્સ રિક્રિએશન સેન્ટર ઓડિટોરિયમમાં યોજાશે. તમે બગીચાકામ કરવા નવા હો અથવા કસાયેલા વ્યવસાયી હો, આપ સૌનું આ કૌટુંબિક-અનુકૂળ પ્રસંગમાં સ્વાગત છે.

30 થી વધારે પ્રદર્શકો સાથે, હાજર મુલાકાતીઓ પાસે નિષ્ણાતોને સાંભળવાની, બગીચાકામને લગતી માહિતી મેળવવાની, બીયારણો વહેંચવાની, આપલે કરવાની અને ખરીદવાની, બગીચાકામ સંબંધિત સમુદાયોમાં જોડાવાની, બાળકો માટેનો કિડ્સ ઝોન જોવાની, અને સીડ્ડી કૅફે (Seedy Café) નો આનંદ માણવાની તક રહેશે.

બગીચાકામ સંબંધિત નિષ્ણાતો દિવસભર ચાર સેમિનારોનું આયોજન પણ કરશે:

- સવારે 10:30 થી 11:15 વાગ્યા સુધી, **Nancy Lotecki-Neely** (નેન્સી લોટેસ્કી-નીલી), ઝીરો વેસ્ટ કેલેડોન, “વ્હાય વેસ્ટ મેટર્સ”
- સવારે 11:30 થી બપોરે 12:15 વાગ્યા સુધી, **Emma Biggs** (એમા બિગ્સ), હોર્ટિકલ્ચરલ રાઈટર એન્ડ બ્રોડકાસ્ટર, “ગાર્ડનીંગ વિથ એમા”
- બપોરે 12:30 થી 1:15 વાગ્યા સુધી, **Brian Millward** (બ્રાયન મિલવાર્ડ), સ્ટેવર્ડશિપ કોર્ડિનેટર, લોકલ એન્હાન્સમેન્ટ એન્ડ અપ્રિશિએશન ઓફ ફોરેસ્ટ્રી (LEAF), “ટ્રીઝ, બીઝ એન્ડ અધર થિંગ્સ”
- બપોરે 1:30 થી 2:15 વાગ્યા સુધી, **Steven Biggs** (સ્ટિવન બિગ્સ), હોર્ટિકલ્ચરલ રાઈટર એન્ડ બ્રોડકાસ્ટર, “એડિબલ્સ ઇન અર્બન લેન્ડસ્કેપ્સ (શહેરી વાતાવરણમાં ખાવાલાયક ખાદ્યપદાર્થો)”

પ્રવેશ મફત રહેશે અને પ્રથમ 100 મુલાકાતીઓ મફતમાં એક છોડ મેળવશે.

આ પ્રસંગનું આયોજન બ્રમ્પટન હોર્ટિકલ્ચરલ સોસાયટી સાથેની ભાગીદારીમાં થઈ રહ્યું છે અને તેને સીડ્સ ઓફ ડાઈવર્સિટીનો ટેકો છે, જે એક કેનેડિયન દાતા સંસ્થા છે અને તે પ્રસ્તુતકર્તા પ્રાયોજક Revera Inc. (રિવેરા ઇન્ક.) સાથે, ખેતીલક્ષી અને બાગાયતી ખેતીલક્ષી જૈવિક વિવિધતાના સંરક્ષણને કટિબદ્ધ છે.

વિગતો માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/parks.

અવતરણો (ક્વૉટ્સ):

“બ્રમ્પટન એક હરિયાળુ શહેર છે અને પર્યાવરણલક્ષી આયોજનો જેમ કે સીડ્ડી સેટરડે (Seedy Saturday) અને બગીચાનું પ્રદર્શન (ગાર્ડન શો) એ આપણી જૈવિક વિવિધતાના મહત્વ પર જગરૂકતા લાવવા માટે મહત્વના છે. આ ઉદ્યોગના નિષ્ણાતો કિડ્સ

ઝોનમાં મહત્વની માહિતી વહેંચશે જેમાં બાળકો ખોરાક ટકાઉપાણું વિશે શીખી શકે છે, આ આયોજન બધી ઉંમરના લોકો માટે રોમાંચક અને શૈક્ષણિક બની રહેવાનું વચન આપે છે!”

- પેટ્રિક બ્રાઉન (*Patrick Brown*), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“ગયા વર્ષે, સીડ્ડી સેટરે અને ગાર્ડન શોમાં 1,100 ઉપરાંત લોકો આકર્ષાયા હતા. હું દરેક વ્યક્તિને હાજર રહેવા પ્રોત્સાહિત કરું છું ખાસ કરીને જો તમને ગ્રીન થમ્બમાં (છોડ વિકસાવવાની કુદરતી કળા જાણવામાં), અને વસંતઋતુમાં વાવેતર વિશે અને તમે બ્રેમ્પટનને હરિયાળુ રાખવામાં કેવી રીતે મદદ કરી શકો છો તે વિશે વધુ જાણવામાં રસ હોય.”

- પૉલ વિસેંટે (*Paul Vicente*), પ્રાદેશિક કાઉન્સિલર અને અધ્યક્ષ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જનીયરિંગ, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન હોર્ટિકલ્ચરલ સોસાયટી 8^{મી} વાર્ષિક સીડ્ડી સેટરે અને ગાર્ડન શો ઉજવવા ફરી એકવાર સીટી ઓફ બ્રેમ્પટન સાથે ભાગીદારી કરવા ઉત્સાહિત છે. આ આયોજન સંપૂર્ણપણે બગીચાકામ, પર્યાવરણલક્ષી ટકાઉપાણું અને સંરક્ષણ વિશે છે ત્યારે, સમુદાયને સાથે લાવવાથી સમુદાયને પોતાના રહેવાના સ્થળને પોષણ આપવાના મહત્વ વિશે જાણવા મળશે.”

- કરોલ સ્પ્રાગ્ગેટ્ટ (*Carole Spraggett*), પ્રમુખ, બ્રેમ્પટન હોર્ટિકલ્ચરલ સોસાયટી

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એન્ગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca